

**ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી**  
**સત્રાંત પરીક્ષા એપ્રિલ - 2011**

અભ્યાસક્રમ	: બેચલર ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફર્મેશન સાયન્સ (BLIS)	નોંધણી નંબર : _____
પાઠ્યક્રમ	: ગ્રંથાલય અને સમાજ (BLIS-01)	
તારીખ	: 21/04/2011	
સમય	: 11.00 to 02.00	
સૂચના	(1) બધાજ પ્રશ્નોના જવાબ આપો. (2) પ્રશ્નોના જવાબ લખતાં પહેલા પ્રશ્નનો કમનંબર અવશ્ય લખવો. (3) બધાજ પ્રશ્નોના ગુણ સરખા છે.	કુલ શુષ્ઠા : 70

પ્રશ્ન:-1 ડૉ. રંગનાથનના ચોથા સૂત્રની વિગતે ચર્ચા કરો. (14)

**અથવા**

સાર્વજનિક ગ્રંથાલયોનો અર્થ સમજાવી તેના કાર્યોની વિગતે ચર્ચા કરો.

પ્રશ્ન:-2 ગ્રંથાલય અધિનિયમની જરૂરિયાત દર્શાવી અધિનિયમના વિવિધ ઘટકોની ચર્ચા કરો. (14)

**અથવા**

સાર્વજનિક ગ્રંથાલય કાયદા ધરાવતા કાજ્યોમાં નાણાંકીય સ્ત્રોતનું વર્ણન કરો.

પ્રશ્ન:-3 ઉપભોક્તા અભ્યાસોના સંચાલન માટે અપનાવાતી કેટલીક પદ્ધતિઓ સમજાવો. (14)

**અથવા**

ગ્રંથાલય ઉપભોક્તા શિક્ષણ માટે ઉપયોગમાં લેવાયેલ પદ્ધતિઓ અને માધ્યમો જણાવો.

પ્રશ્ન:-4 રાજારામ મોટર્સ લાઈબ્રેરી ફાઉન્ડેશનનું ગ્રંથાલય ક્ષેત્રે પ્રદાન જણાવો. (14)

**અથવા**

અમેરિકાની લાઈબ્રેરી એસોસિએશનના (ALA) હેતુઓ અને કાર્યો વિગતે સુચારા.

પ્રશ્ન:-5 ટૂરનોંદ લખો. (કોઈપણ ત્રણ) (14)

1. વિશિષ્ટ ગ્રંથાલયો
2. ઈન્ફલીબનેટ
3. વ્યવસ્થાપિક નીતિમતા
4. ઈન્ડિયન લાઈબ્રેરી એસોસિએશન (ILA)
5. શાળા ગ્રંથાલય

## ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી સત્રાંત પરીક્ષા એપ્રિલ - 2011

અભ્યાસક્રમ	: બેચલર ઓફ લાયબ્રેરી એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (BLIS) નોંધણી નંબર : _____
પાઠ્યક્રમ	: ગ્રંથાલય પ્રબંધન (BLIS-02)
તારીખ	: 25/04/2011
સમય	: 11.00 to 02.00
સૂચના	: (1) બધાજ પ્રશ્નોના જવાબ આપો. (2) પ્રશ્નોના જવાબ લખતાં પહેલા પ્રશ્નનો કમનંબર અવશ્ય લખવો. (3) બધાજ પ્રશ્નોના ગુણ સરખા છે. <b>કુલ શુણાવો : 70</b>

પ્રશ્ન:-1 ગ્રંથાલયમાં સંચાલનની આવશ્યકતા જણાવી POSDCORB સિદ્ધાંતો દ્વારા  
સંચાલનની પ્રક્રિયા સમજાવો. (14)

### અથવા

કુશળ સંગાઈનાત્મક સંરચનાના નિર્માણ માટે આવશ્યક સંગાઈના સિદ્ધાંતોની વિસ્તૃત  
સમજ આપો.

પ્રશ્ન:-2 આદર્શ ગ્રંથાલય ભવન વિશેના તમારા રાયનો જણાવો. (14)

### અથવા

કર્મચારી આયોજન સાથે સંબંધિત રૂપોને વિસ્તારથી વર્ણવો.

પ્રશ્ન:-3 ગ્રંથાલયમાં ગ્રંથો અને સામાચિકના પસંદગી માટેના વિવિધ ઉપકરણો (Tools) નું  
મહત્વ સમજાવો. (14)

### અથવા

ગ્રંથાલયમાં ગ્રંથોની પસંદગી અને પ્રાપ્તિમાં ઉભી થતી સમસ્યાઓ વિશે વિસ્તૃત  
સમજ આપો.

પ્રશ્ન:-4 ગ્રંથાલયની માહિતી કેન્દ્રોમાં સર્વાંગી સંચાલન (TQM) નું મહત્વ સમજાવો. (14)

### અથવા

ગ્રંથાલય અંદાજપત્ર તૈયાર કરવામાં કઈ કઈ બાબતોને આવરી લેવામાં આવે છે ?  
સમજાવો.

પ્રશ્ન:-5 ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (14)

1. ગ્રંથાલય ફર્નિચર (રાચરચિલું)
2. સામાચિક નોંધણીની પદ્ધતિઓ
3. શૂન્ય આધારિત અંદાજપત્ર (Zero base budgeting)
4. ગ્રંથ પ્રાપ્તિ વિભાગના પત્રકો અને નોંધો
5. ભાઉન પદ્ધતિ

**ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી**  
**સત્રાંત પરીક્ષા એપ્રિલ - 2011**

**અભ્યાસક્રમ** : બેચલર ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફર્મેશન સાયન્સ (BLIS)  
નોંધણી નંબર : \_\_\_\_\_

**પાઠ્યક્રમ** : ગ્રંથાલય વર્ગીકરણ સિદ્ધાંત (BLIS-03)

**તારીખ** : 25/04/2011

**સમય** : 03.00 to 06.00

**સૂચના** : (1) બધાજ પ્રશ્નોના જવાબ આપો.

(2) પ્રશ્નોના જવાબ લખતાં પહેલા પ્રશ્નનો કમનંબર અવશ્ય લખો.

(3) બધાજ પ્રશ્નોના ગુણ સરખા છે.

**કુલ ગુણ : 70**

**પ્રશ્ન:-1** વર્ગીકરણ એટલે શું ? વર્ગીકરણના પ્રકારો ગણાક્ષમ અને મુખ્યક્રિય વર્ગીકરણ  
પદ્ધતિઓની ચર્ચા કરો. (14)

**અથવા**

ગ્રંથાલય વર્ગીકરણના જુદા-જુદા સિદ્ધાંતો આપી, ડૉ. રંગનાથન અને કલાસિકલ રિસર્ચ ગુમ(લંડન) ના યોગદાન વિષે નોંધ લખો.

**પ્રશ્ન:-2** “ગ્રંથાલયશાસ્ત્રના પાંચ સૂત્રોના અમલીકરણ સાત વિષય વિશ્વનાં માળખાં અને તેના  
વિકાસનો અભ્યાસ કરવો જોઈએ” આ વિચાન સમજાવો. (14)

**અથવા**

વિષય રચનાની વિવિધ લઢ્ઠો કણી છે ? ઉદાહરણ સહિત સમજાવો.

**પ્રશ્ન:-3** પ્રલેખના પ્રાયોગિક વર્ગીકરણ માટે આવશ્યક ચરણો જણાવી, અભિધારણાત્મક  
અભિગમના લાભો જણાવો. (14)

**અથવા**

ડૉ. રંગનાથની પાંચ મૂળભૂત શ્રેષ્ઠીઓ દેખાંત સહિત સમજાવો.

**પ્રશ્ન:-4** ડિડિસીમાં માન્ય પેટા વિભાગો જોડતી વખતે કેટલીક જગ્યાએ બે કે વધારે શૂન્ય  
જોડતી જરૂર પડે છે શા માટે ? વિગતે ચર્ચા. (14)

**અથવા**

પંક્તિ અને શુંખલામાં સ્વાગતશીલતા સુનિશ્ચિત કરવા માટે પ્રયોગમાં લેવામાં આવતી  
યુક્તિઓના નામ આપો.

**પ્રશ્ન:-5** ટૂંકનોંધ લખો. (કોઈપણ ત્રણ) (14)

1. DDCની સાત સારણીઓ
2. મુક્ત મુખ્યક્રિય વર્ગીકરણ
3. VDCના ગુણો અને ખામીઓ
4. સ્મૃતિ સહાયકો
5. કલ્યાણ સમંકના ઘટકો.

**ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી**  
**સત્રાંત પરીક્ષા એપ્રિલ - 2011**

અભ્યાસક્રમ	: બેચલર ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફર્મેશન સાયન્સ (BLIS)
	નોંધણી નંબર : _____
પાઠ્યક્રમ	: ગ્રંથાલય સૂચિકરણ સિદ્ધાંત (BLIS-04)
તારીખ	: 26/04/2011
સમય	: 11.00 to 02.00
સૂચના	: (1) બધાજ પ્રશ્નોના જવાબ આપો. (2) બધાજ પ્રશ્નોના ગુણ સરખા છે. (3) પ્રશ્નોના જવાબ સમર્થન માટે યોગ્ય ઉદાહરણ આપવા સાથે જરૂરિયાત મુજબ આકૃતિઓ ઉપયોગ પણ કરો.
	કુલ ગુણ : 70

પ્રશ્ન:-1 પુસ્તકાલય સૂચિના ભૌતિક સ્વરૂપો સમજાવી અન્ય સ્વરૂપોના તુલનામાં પત્રકસૂચિ શા માટે વધુ લોકપ્રિય છે જણાવો. (14)

**અથવા**

સી. એ. કટર દ્વારા નિર્મિત પુસ્તકાલય સૂચિના પાઠોના ઉલ્લેખ કરી પુસ્તકાલય વિજ્ઞાનનાં પાંચ સૂત્રોની સાર્થકતામાં પુસ્તકાલય સૂચિકરણની ભૂમિકા ચર્ચો.

પ્રશ્ન:-2 એ. એ. સી. આર-2 આર માં આપવામાં આવતા માહિતી(ડિટા)તત્ત્વ વિવરણોનાં વિવિધ સ્તરોની ઉદાહરણ સહિત સમજૂતી આપો. (14)

**અથવા**

વિષય સૂચિ એટલે શું ? તેની ઉદ્દેશ્યો અને વિવિધ પ્રકારો વિશે વિગતે ચર્ચા કરો.

પ્રશ્ન:-3 સમાચિત લેખકની વ્યાખ્યા આપી એ.એ.સી.આર. – 2 આરમાં સરકારી પ્રલેખોના સૂચિકરણ માટે પાત્રમોની ચર્ચા કરો. (14)

**અથવા**

કેન્દ્રીય સૂચિકરણ એટલે શું ? તે વિગતે સમજાવી તેના લાભ અને ઉણાપો વિશે ચર્ચા કરો.

પ્રશ્ન:-4 નિર્દેશિકા (અનુક્રમણિકારણ) પદ્ધતિની વ્યાખ્યા આપી, પૂર્વ-સંકલિત અને પ્રશ્નાત અનુભૂત નિર્દેશિકારણ વિશે વિગતે નોંધ લખો. (14)

**અથવા**

થિસોરસ એટલે શું ? સમજાવી તેના પ્રકારો અને કાર્યોની ચર્ચા કરો.

પ્રશ્ન:-5 ટુંકનોંધ લખો. (ગમે તે બે) (14)

(અ) સાંકળ પદ્ધતિ

(બ) શબ્દભંડેળ નિયંત્રણ

(ક) સંઘસૂચિ

(દ) ગ્રંથાલય નેટવર્ક

**ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી**  
**સત્રાંત પરીક્ષા એપ્રિલ - 2011**

અભ્યાસક્રમ	: બેચલર ઓફ લાયબ્રેરી એન્ડ ઈન્ફર્મેશન સાયન્સ (BLIS)	નોંધણી નંબર : _____
પાઠ્યક્રમ	: સંદર્ભ અને માહિતી સ્ત્રોતો (BLIS-05)	
તારીખ	: 26/04/2011	
સમય	: 03.00 to 06.00	
સૂચના	(1) બધાજ પ્રશ્નોના જવાબ આપો. (2) પ્રશ્નોના જવાબ લખતાં પહેલા પ્રશ્નનો કમનંબર અવશ્ય લખવો. (3) બધાજ પ્રશ્નોના ગુણ સરખા છે.	કુલ ગુણ : 70

પ્રશ્ન:-1 “વિશ્વકોશ ગ્રંથાલયનાં સંદર્ભકાર્યમાં કરોડરજ્જુ સમાન છે” ના વાક્ય સમજાવો.  
સામાન્ય વિશ્વકોશ અને વિષય વિશ્વકોશ વચ્ચેનું અંતર અધ્યાત્મ કરો. (14)

**અથવા**

સંદર્ભ ગ્રંથ એટલે શું ? સંદર્ભ ગ્રંથોના મૂલ્યાંકન ઘોરણોની વિગતે ચર્ચા કરો.

પ્રશ્ન:-2 શબ્દકોશની વ્યાખ્યા આપી જુદા જુદા પદરના શબ્દકોશોની સમજૂતી આપો. (14)

**અથવા**

વાર્ષિકી, પંચાંગ અને હેન્ડબુક્ઝી વ્યાખ્યા આપી. ઉદાહરણ સહિત પંચાંગની વિભિન્ન શ્રેષ્ઠી સમજાવો.

પ્રશ્ન:-3 વાર્ષિક્યસૂચિ તેટલે શું ? જુદાં જુદાં પ્રકારની વાર્ષિક્યસૂચિઓ ઉદાહરણ સાથે સમજાવો. (14)

**અથવા**

જીના રિત્ર સ્ત્રોતોનું મૂલ્યાંકન કરો અને કોઈપણ એક જીવનચરિત્ર સ્ત્રોત વિષે લખો.

પ્રશ્ન:-4 ભૌગોલિક સ્ત્રોતોના મૂલ્યાંકનનાં પગથિયા લખો. જુદા જુદા પ્રકારનાં ભૌગોલિક સ્ત્રોતો સમજાવો. (14)

**અથવા**

લોક માધ્યમ એટલે શું ? તેની પદ્ધતિઓ વિસ્તૃત રૂપે સમજાવો.

પ્રશ્ન:-5 નીચેના દરેક પ્રશ્નમાંથી ઓછામાં ઓછા ત્રણ પ્રશ્નો પસંદ કરી કોઈપણ ચૌદ (14) પ્રશ્નોના જવાબ આપો. (14)

(ક) નીચે આપેલમાંથી સંદર્ભ સ્ત્રોતનું નામ બતાવો.

1. દ્વિભાષી શબ્દકોશ
2. સામાન્ય હેન્ડબુક
3. વાર્ષિકસ્ટ્રોટ
4. કોઈપણ ભારતીય ભાષામાં પ્રકાશિત વિશ્વકોશ
5. વાર્ષિકી

(ખ) નીચે મુજબના સંદર્ભસ્ત્રોતોમાંથી કેવા પ્રકારની માહિતી પ્રાપ્ત કરી શકાય છે ?

1. કેમિકલ એઝ્યુફ્રેક્ટ
2. ઇન્ડિયા હુઝુ
3. વ્યાવસાયિક ડિરેક્ટરી
4. વેબસ્ટર્સ જ્યોગ્રાફિકલ ડિક્શનરી
5. યુનિવર્સિટી હેન્ડબુક

(ગ) નીચે આપેલ સંદર્ભ પુસ્તકોના વિધાનક્ષત્રનું વર્ણન કરો.

1. મનોરમા ઈયરબુક
2. અનસાયકલોપિડીયા લિટરેરી
3. ફીઝ વર્કિંગ
4. સ્ટેટેસ્ટીકલ એઝ્યુફ્રેક્ટ ઓફ ઇન્ડિયા
5. સાયન્સ ઐન્ટેશન ઇન્ડેક્શન

(ધ) નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર માટે ઓછામાં ઓછા એક સંદર્ભ સ્ત્રોતનું નામ આપો.

1. IPRનું પુરુંનામ
2. UNOનું સરનામું
3. 2009નું સૂર્યગહણ
4. ભારતયાત્રાનો સર્વોત્તમ સમય
5. ‘અર્થકવેક’ શબ્દનો અર્થ

**ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી**  
**સત્રાંત પરીક્ષા એપ્રિલ - 2011**

અભ્યાસક્રમ	: બેચલર ઓફ લાયબ્રેરી એન્ડ ઇન્ફરમેશન સાયન્સ (BLIS)	નોંધણી નંબર : _____
પાઠ્યક્રમ	: માહિતી સેવાઓ (BLIS-06)	
તારીખ	: 27/04/2011	
સમય	: 11.00 to 02.00	
સૂચના	(1) બધાજ પ્રશ્નોના જવાબ આપો. (2) પ્રશ્નોના જવાબ લખતાં પહેલા પ્રશ્નનો કમનંબર અવશ્ય લખવો. (3) બધાજ પ્રશ્નોના ગુણ સરખા છે.	કુલ ગુણ : 70

પ્રશ્ન:-1 માહિતી એટલે શું ? આજના યુગમાં વિવિધ ક્ષેત્રોમાં માહિતીની અગત્યતા સમજાવો. (14)

**અથવા**

મૂલ્યવર્ધિત સેવાઓ ઊભી કરવા માટે કયા પાસાઓનું વિશે મહત્વ છે ? – સમજાવો.

પ્રશ્ન:-2 ભારતમાં વિવિધ વિષયક્ષેત્રોમાં પ્રલેખન અને માર્ગદારી કન્દ્રો દ્વારા આપવામાં આવતી સેવાઓ વિશે નોંધ લખો. (14)

**અથવા**

શૈક્ષણિક ગ્રંથાલયોમાં સંદર્ભ વિભાગ તથા તેમના ઉપભોક્તાઓને આપવામાં આવતી સંદર્ભ સેવાઓ વિશે તમારા વિચારો સ્પષ્ટ કરો.

પ્રશ્ન:-3 ‘ઉપભોક્તાઓને નવી ગ્રંથાલય મામગ્રી અને અધ્યતન પ્રવાહોથી સતત પરિચિત રાખવા માટે અધ્યતન અવસ્થાધિન સેવા (CAS) ઉપકારક બને છે’ – સમજાવો. (14)

**અથવા**

પસંદગી યુક્ત માર્ગદારી પ્રસાર સેવા (SDI) કોને અને કઈ રીતે આપવામાં આવે છે ? વિસ્તારથી સમજાવો.

પ્રશ્ન:-4 આજના યુગમાં પ્રલેખ પૂર્તિ સેવા (Document – Delivery Service) નું મહત્વ સમજાવી, અંગે આપવામાં આધુનિક ઉપકરણોનો ઉપયોગ કઈ રીતે થાય છે તે સમજાવો. (14)

**અથવા**

સાહિત્ય શોધ (Literature Search) માં સમાવિષ્ટ વિવિધ સોપાનો (Steps) જણાવો.

પ્રશ્ન:-5 ટૂંકનોંધ લખો. (કોઈપણ બે) (14)

1. ઓનલાઈન શોધ (Online search)
2. ઉપભોક્તા પ્રશિક્ષણ (User education)
3. સમાચાર કતરણ સેવા (News clipping service)
4. અનુવાદ સેવાની જરૂરિયાત (Need of Translation service)
5. પ્રતિનિર્માણ સેવાના ફાયદા (Merits of Reprography service)

**ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી**  
**સત્રાંત પરીક્ષા એપ્રિલ - 2011**

અભ્યાસક્રમ	: બેચલર ઓફ લાયબ્રેરી એન્ડ ઇન્ફર્મેશન સાયન્સ (BLIS) નોંધણી નંબર : _____
પાઠ્યક્રમ	: માહિતી મૂળ તત્ત્વો અને વિનિયોગ (BLIS-07)
તારીખ	: 27/04/2011
સમય	: 03.00 to 06.00
સૂચના	: (1) બધાજ પ્રશ્નોના જવાબ આપો. (2) બધાજ પ્રશ્નોના ગુણ સરખા છે. (3) જરૂર પડ્યે આકૃતિ દોરવી જવાબની સામે યોગ્ય ફ્રમાંક લખવો.

કુલ ગુણ : 70

પ્રશ્ન:-1 માહિતી ટેકનોલોજી (IT) શબ્દનો અર્થ સમજાવો અને તેના ઘટકોનું ટૂંકમાં વર્ણન કરો.(14)

**અથવા**

પ્રોસેસર અને સ્ટોરેજ ટેકનોલોજી વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો અને આ ક્ષેત્રના કેટલાક ખાસ વિકાસની રૂપરેખા આપો.

પ્રશ્ન:-2 સોફ્ટવેરનો અર્થ શું છે ? વિવિધ પ્રકારના સોફ્ટવેરના હેતુઓ અને ખાસિયતો / લક્ષણો જણાવો. (14)

**અથવા**

કોમ્પ્યુટર ટેકનોલોજીને તેના વિકાસ અધારે વિવિધ સમૂહોમાં વિભાજિત કરવામાં આવે છે. આ દરે પ્રકારની ખાસિયતોની ચર્ચા કરો.

પ્રશ્ન:-3 પ્રત્યાયન પદ્ધતિના વિવિધ સમૂહોની લાક્ષણિકતાઓ સમજાવો અથવા ટેલિકોમ્પ્યુનિકેશન નેટવર્કમાં વપરાતાં મધ્યોળી ચર્ચા કરો. (14)

**અથવા**

CDS/ISIS (માર્ક્ષી વર્જન)ની મુખ્ય લાક્ષણિકતાઓની ચર્ચા કરો અને તે જ પેકેજ દ્વારા આપવામાં આવતી ઇન્ડેક્સિંગ પદ્ધતિની ચર્ચા કરો.

પ્રશ્ન:-4 SDI એ મૂળભૂત ખ્યાલ સમજાવો તેમજ તે કેવી રીતે આપવામાં આવે છે તેની વિગતવાર ચર્ચા કરો. (14)

**અથવા**

ઇન્ટરનેટ અને ઇન્ટ્રાનેટ એટલે શું ? ઇન્ટરનેટની સાથે સંકળાયેલ ટેકનિકલ બાબતોની ચર્ચા કરો તથા ઇન્ટરનેટની અગત્યતા સમજાવો.

પ્રશ્ન:-5 નીચેનામાંથી ગમે તે ત્રણ પર ટૂંકનોંધ લખો. (14)

- (અ) સ્ટાન્ડર્ડ અને પ્રોટોકોલ
- (બ) ડેલનેટ સેવાઓ
- (ક) ભારતના નોન-બિલ્લીઓગ્રાફીક ડેટા નેટવર્ક
- (દ) ટ્રેકેશન શોધ અને તેની અસરો
- (ઇ) CD-ROM ડેટાબેઝની પસંદગી અંગેના માપદંડો